

#### ANUPAM RASAYAN INDIA LTD.

ARILSLDSTX20220815043

To,

BSE Limited,

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street,

Mumbai -400001, India

SCRIP CODE: 543275

To.

Sr. General Manager

National Stock Exchange of India

Date: August 15, 2022

Limited

'Exchange Plaza', C-1, Block-G,

Bandra Kurla Complex

Bandra (East), Mumbai 400051, India

**SYMBOL: ANURAS** 

Dear Sir/Madam,

Subject: Newspaper Advertisement-Disclosure under Regulation 30 and Regulation 47 of Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations")

Pursuant to the Regulation 47 read with Regulation 30 of the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith the copies of newspaper advertisement published on August 14, 2022 in Financial Express (English) and Dhabkar (Gujarati) in compliance with the Ministry of Corporate Affairs General Circular nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020, 21/2021 dated December 14, 2021, 02/2022 dated May 5, 2022, intimating that 19th Annual General Meeting of the Anupam Rasayan India Limited ("Company") will be held on Thursday, September 15, 2022 at 4:30 p.m. (IST) through Video Conferencing / Other Audio Visual Means.

Copies of enclosed newspaper advertisements is also uploaded on the Company's website www.anupamrasayan.com.

We request you to kindly note the same and take into your records.

Thanking you, Yours Faithfully, For, Anupam Rasayan India Limited

Suchi Agarwal Company Secretary & Compliance Officer

M.N.: A32822

Encl: As above

Registered Office: 8110, GIDC Industrial Estate, Sachin, SURAT-394 230 Gujarat, India. Tel. : +91-261-2398991-95
Fax : +91-261-2398996

E-mail : office@anupamrasayan.com Website : www.anupamrasayan.com

CIN - L24231GJ2003PLC042988

28

WWW.FINANCIALEXPRESS.COM



## SMS PHARMACEUTICALS LIMITED

CIN:L24239TG1987PLC008066.

Regd. Office: Plot No. 72, H.No: 8-2-334/3 & 4, Road No. 5, Opp. SBI Executive Enclave, Banjara Hills, Hyderabad TG 500034 Phone: 040-35359999, Fax:040-25259889, Email: complianceofficer@smspharma.com, www.smspharma.com

(₹ in Lakhs) Consolidated Standalone SI. **Particulars** Quarter ended | Quarter ended | Year ended Quarter ended Quarter ended Year ended No. 30.06.2022 | 30.06.2021 | 31.03.2022 | 30.06.2022 30.06.2021 31.03.2022 (Audited) (Unaudited) (Audited) (Audited) (Unaudited) (Audited) Total Income from Operations (net) 16,428.73 52,507.20 16,428.73 52,507.20 6.519.00 6.519.00 Profit from Ordinary Activities after Tax (after Extraordinary Items) 6,803.65 (1,276.69)2,356.27 6,221.99 (980.54)2,319.94 Total Comprehensive Income for the guarter (comprising profit/Loss) for 2.314.73 6,807.58 (1,274.59)2.352.81 6,230.00 (979.46)the guarter (after tax) and other comprehensive items) Equity Share Capital (Face value of share: Re.1/- each) 846.52 846.52 846.52 846.52 846.52 846.52 Reserves (excluding Revaluation Reserve as per Balance Sheet) 48,529.50 46,182.34 Earnings per share (before extraordinary items - (Not annualized) a) Basic/Diluted (in Rs) (1.16)2.74 8.04 (1.51)2.78 7.35

Extract of Financial Results for the Quarter Ended 30th June, 2022

1 The above Standalone and consolidated Financial Results have been reviewed and recommended by the Audit Committee in its meeting held on 12.08.2022 and approved by the Board of Directors in their meetings held on 13th August, 2022 and Statutory Auditors of the Company have carried out a Limited Review.

2 These results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed Under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.

3 The above is an extract of detailed format of guarterly / annual financial results filed with the stock exchanges under regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of quarterly / annual financial results are available on the website of the Stock Exchanges of BSE www.bseindia.com(ID 532815) or NSE (www.nseindia.com) and companies website (www.SMSPHARMA.com).

By order of the Board For SMS Pharmaceuticals Limited Ramesh Babu Potluri Chairman & Managing Director (DIN:00166381)

calsoft

Realize Your Ideas

Place: Chennai

Date: 12.08.2022

Place: Hyderabad

Date: 13.08.2022

## CALIFORNIA SOFTWARE COMPANY LIMITED

Workflo, Greeta Tower, Industrial Estate, Perungudi, OMR Phase 1, Chennai - 600 096. E-mail: investor@calsoftgroup.com CIN: L72300TN1992PLC022135 Ph: 9444 860 882

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED AND STANDALONE FINANCIAL RESULTS (UNAUDITED) FOR THE QUARTER ENDED JUNE 30, 2022 (Rs.in Lakhs)

		9.7	Standalon	е	Consolidated			
SI. No.	Particulars	Quarter ended 31.06.2022	Quarter ended 31.03.2022	Quarter ended 30.06.2021	Quarter ended 30.06.2022	Quarter ended 31.03.2022 (Audited)	Quarter ended 30.06.2021 (Unaudited)	
NO.		(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)			
1	Total Income from operations (net)		0.73	350.00	100.24	0.73	350.00	
2	Net Profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	40.97	(81.21)	294.96	40.97	(81.23)	294,96	
3	Net Profit / (loss) for the period (before tax, exceptional items and/ or extraordinary items)	40.97	(81.21)	294.96	40.97	(81.23)	294.96	
4	Net Profit / (loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	40.97	(206.54)	294.96	40.97	(206.56)	294.96	
5	Total comprehensive income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	40.97	(206.54)	294.96	40.97	(206.56)	294.96	
6	Paid-up Equity Share Capital	154.57	154.57	154.57	154.57	154.57	154.57	
7	Earnings Per Share (of Rs.10/- each)				1000			
	1. Basic	0.27	(1.34)	1,91	0.27	(1.34)	1.91	
	2. Diluted	0.27	(1.34)	1.91	0.27	(1.34)	1.91	

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites www.nseindia.com and www.bseindia.com and also on the company's website www.calsoftgroup.com

For California Software Company Limited

Dr. Mahalingam Vasudevan Managing Director & CEO DIN - 01608150

HOVS **HOV Services Limited** 

Registered Office: 3rd Floor Sharda Arcade, Pune Satara Road, Bibwewadi, Pune-411037 CIN: L72200PN1989PLC014448; website: www.hovsltd.com; email: investor.relations@hovsltd.com

STATEMENT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022

	STAN	DALONE (Rs. In	Lakhs)	CONSOLIDATED (Rs. In Lakhs)			
	Quarter Ended		Year Ended	Quarter Ended		Year Ended	
	Jun 30,2022 Unaudited	Jun 30,2021 Unaudited	Mar 31,2022 Audited	Jun 30,2022 Unaudited	Jun 30,2021 Unaudited	Mar 31,2022 Audited	
Total income from operations (Net)	345.69	278.14	1,140.14	447.18	278.14	1,140.14	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	95.99	71.54	301.01	197.48	71.54	301.01	
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional items)	95.99	71.54	(6,306.69)	197.48	71.54	301.01	
Net Profit / (Loss) for the period after tax of continuing operations	70.95	52.40	(6,393.52)	172.44	52.40	214.18	
Net Profit / (Loss) for the period after tax of discontinued operations			-	(8.91)	(0.41)	1.53	
Total Comprehensive Income for the period	70.95	52.40	(6,395.07)	(140.31)	654.04	(6,845.42)	
Equity Share Capital	1,259.50	1,258.90	1,259.50	1,259.50	1,258.90	1,259.50	
Earnings Per Share - Basic & Diluted (of Rs 10 each)							
Before exceptional item - continuing operations	0.56	0.42	1.70	1.37	0.42	1.70	
After exceptional item - discontinued operations	0.56	0.42	(50.78)	(0.07)	(0.00)	0.01	
After exceptional item - continuing & discontinued operation	0.56	0.42	(50.78)	1.30	0.41	1.71	

Note 1: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI(listing Obligations and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter ended Financial Results are available on the Stock Exchange websites www.bseindia.com and www.nseindia.com and on the Company's website www.hovsltd.com.

Note 2: The above Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on August 13, 2022. The Statutory Auditors of the Company have audited the financial results for the guarter ended June 30, 2022 in terms of Regulations 33 of SEBI(Listing and Other Disclosure Requirements) Regulations, 2015.

Place: Pune Date: August 13, 2022

For, HOV Services Limited Vikram Negi Chairman & Executive Director (DIN:01639441)

#### **SUUMAYA INDUSTRIES LIMITED** (Formerly known as Suumaya Lifestyle Limited)

CIN: L18100MH2011PLC220879 Regd. Off: Wing A, B & F, Unit No.2001, 2002, 20th Floor Lotus Corporate Park, Goregaon East Mumbai MH400063 IN

Tel. No. 022-69218000 | Website: www.suumaya.com EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022



	(₹ in cro								
		Standalone				Consolidated			
SL	Particulare		Quarter Ende		Year ended		Quarter Ende		Year ended
No.	Particulars	30.06.2022	31.03.2022	30.06.2021	31.03.2022	30.06.2022	31.03.2022	30.06.2021	31.03.2022
40000		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operation	143.08	1,283.32	2,866.26	6,754.23	332.53	1,802.37	6,852.14	12,816.24
2	Net Profit / (Loss) for the period								
	(before Tax, Exceptional and/or Extraordinary items)	5.70	379.15	166.88	866.82	8.86	522.37	340.83	1,310.46
3	Net Profit / (Loss) for the period before tax	0000000	\$20,000 (C.000.0)	01/2001/2006	3832655335	2011042	V20-3-753-00-0	Contraction of	INTERCORRECTO
5550	(after Exceptional and/or Extraordinary items)	5.70	99.82	166.88	587.50	8.86	243.04	340.83	1,031.13
4	Net Profit / (Loss) for the period after tax								175
	(after Exceptional and/or Extraordinary items)	4.20	22.70	140.23	429.91	6.92	181.98	305.53	872.56
5	Total Comprehensive Income for the period	2000000	tooteen, rijke,	0.000000000	10.0000180000	21010000	17/20/01/08/200	1315-61-000390	100000000000000000000000000000000000000
5500	[Comprising Profit / (Loss) for the period (after tax) and			200000000	200305500		****************		
	Other Comprehensive Income(after tax)]	4.20	22.70	140.23	429.91	6.92	181.98	305.53	872.56
6	Equity Share Capital	61.14	30.57	28.07	30.57	61.14	30.57	28.07	30.57
7	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and								1
	discontinued operations) - (not annualised)								
	1. Basic:	0.69	4.05	24.98	76.59	1.13	32.42	54.43	155.44
	2. Diluted:	0.66	3.51	22.07	66.46	1.10	28.13	48.08	134.89

\* Not Annualised Notes

Place: Mumbai

Date : August 12, 2022

The above unaudited Standalone and Consolidated financial results were reviewed and recommended by the Audit Committee and further considered and approved by the Board of Directors at their meeting held on August 12, 2022. The limited review under regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 has been carried by the Statutory Auditors of the Company.

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (URLwww.nseindia.com) and also available on website of the Company at www.suumaya.com For and on behalf of the Board of Directors

> Suumava Industries Limited (Formerly known as Suumaya Lifestyle Limited) Ushik Gala

Chairman and Managing Director DIN: 06995765 ARCHIDPLY DECOR LIMITED

CIN: L20231UR2017PLC008626 Registered office Plot no. 7, Sector - 9, Integrated Industrial Estate, SIDCUL, Pant Nagar, Rudrapur, Udham Singh Nagar - 263153, Uttarakhand website : www.archidplydecor.com, email : bangalore@archidply.com Tel: 05944 250 270, Fax No.05944 250269

(Rs. In Lakhs)								
Q	Year Ended							
30.06.2022 Unaudited	31.03.2022 Audited		100 CH 100 CH 100 CH 100 CH					
1,032.97	1,183.18	703.81	4,305.61					
34.34	38.51	(56.98)	29.11					
34.34	38.52	(55.70)	30.12					
24.47	27.69	(42.02)	19.71					
27.46	31.47	(38.37)	31.51					
556.63	556.63	556.63	556.63					
0.44	0.50	-0.75	0.35					
	30.06.2022 Unaudited 1,032.97 34.34 34.34 24.47 27.46 556.63	30.06.2022 31.03.2022 Unaudited Audited 1,032.97 1,183.18 34.34 38.51 34.34 38.52 24.47 27.69 27.46 31.47 556.63 556.63	Quarter Ended           30.06.2022         31.03.2022         30.06.2021           Unaudited         Audited         Unaudited           1,032.97         1,183.18         703.81           34.34         38.51         (56.98)           34.34         38.52         (55.70)           24.47         27.69         (42.02)           27.46         31.47         (38.37)           556.63         556.63         556.63					

Place : Bangalore

- 1. The above unaudited Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its meetings held on 13th August, 2022. The Statutory Auditor has issued an unqualified Auditor's report thereon.
- 2. This unaudited Financial Results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Sec 133 of Companies Act, 2013 and other recognised accounting practises and policies to the extent applicable.
- 3. Figures for the previous periods have been regrouped and reclassified to confirm to the classification of the current period, wherever necessary.
- There are no exceptional/extraordinary items during the guarter ended 30<sup>th</sup> June, 2022. 5. The above is an extract of the detailed format of Quarterly and Annual Financial Results filed with the Stock Exchanges and Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Annual Financial Results

on the Company's website www.archidplydecor.com. For Archidply Décor Ltd., Date : August 13, 2022 Shyam Daga

are available on the stock exchanges websites - www.nseindia.com, www.bseindia.com and

#### SHANTI OVERSEAS (INDIA) LIMITED CIN: L51211MP2011PLC025807

Regd. Office: 215-216, VIKRAM TOWER, 15T FLOOR, SAPNA SANGEETA ROAD, INDORE MP 452001 IN Website: www.shantioverseas.com ; E-mail: mail@shantioverseas.com ; Tel: +91-731-4020586, +91-731-4020587

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30™ JUNE,2022 (Rs in Lakhs)

Sr.	Particulars	Quarter Ended	Quarter Ended	Quarter Ended	Year Ended	
No		30-06-2022	31-03-2022	30-06-2021	31-03-2022	
- 4		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	
1 2	Total Income From Operation Net Profit / (Loss) (before taxes	9,912.84	12,023.95	2,726.80	20,307.18	
500	and Extraordinary items)	(221.59)	965.48	(8.16)	334.93	
3	Net Profit / (Loss) before taxes (after Extraordinary items)	(221.59)	965.48	(8.16)	334.93	
4	Net Profit / (Loss) after taxes ( after Extraordinary items)	(218.04)	809.72	(8.16)	309.70	
5	Total Comprehensive Income for the period (comprising profit (loss) and other comprehensive income for the	(047.00)	040.70	10.467	242.70	
6	period after tax) Paid-up equity share capital	(217.29)	812.72	(8.16)	312.70	
ಁ	(Face Value Rs.10/- each)	1,110.60	1,110.60	1,110.60	1,110.60	
7	Reserve (excluding Revaluation Reserves as per balance sheet of		11.040007476.0	323,7000		
В	previous accounting year) Earnings per share (for discontinued & continuing operation) :				2,128.32	
	(a) Basic	(1.96)	7.29	(0.07)	2.79	
	(b) Diluted	(1.96)	2200655363	(0.07)	2.79	

The Consolidated Financial Results for the Quarter ended on 30" June, 2022 have been prepared in accordance with the Companies (Indian Accounting Standard) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable beginning 1st April, 2020, the Company has for the first time adopted Ind AS with the transition date of 1st April, 2019.

Sr.	Particulars	Quarter Ended	Quarter Ended	Quarter Ended	Year Ended	
No		30-06-2022	31-03-2022	30-06-2021	31-03-2022	
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	
T	Total Income from operations (net)	1,637.33	1,768.90	2,708.55	7,014.40	
ii.	Profit/Loss before tax	(121.03)	199.42	106.52	57.80	
iii	Profit/Loss after tax	(118.67)	144.52	128.45	50.66	

and thereafter approved by Board of Directors at their meeting held on 12th August, 2022. 4 The previous period figures have been regrouped/rearranged wherever found necessary.

5 The above is an extract of the detailed format of Consolidated and Standalone Financial Results for the guarter ended on 30th June, 2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Consolidated and Standalone Financial Results for the guarter ended on 30th June, 2022 are available on the website of the Company i.e. www.shantioverseas.com and on the website of NSE (www.nseindia.com).

Ayush Kacholia Place: Indore Whole-Time Director Date: 12/08/2022 DIN 03096933



Regd. office: Anupam Rasayan India Ltd. 8110, Sachin G.I.D.C. Industrial Estate, Sachin, Surat - 394230, Gujarat, India, Tel: +91 261 2398991-95.

CIN - L24231GJ2003PLC042988

Website: www.anupamrasayan.com, Email: investors@anupamrasayan.com INFORMATION REGARDING NINETEENTH (19™) ANNUAL GENERAL

MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCE OR OTHER AUDIO-VISUAL MEANS

Notice is hereby given that the Nineteenth (19th) Annual General Meeting (AGM) of the Anupam Rasayan India Limited (the "Company") will be held through VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO-VISUAL MEANS (DAVM) on September 15, 2022, Thursday at 4:30 p.m. (Indian Standard Time) in compliance with Circular No. 02/2021 dated January 13, 2021 read together with Circular No. 14/2020 dated April 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 20/2020 dated May 5, 2020, Circular No. 21/2021 dated December 14, 2021, Circular No. 02/2022 dated May 05, 2022 and all other relevant circulars issued from time to time, by the Ministry of Corporate Affairs (MCA) and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 read with Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, issued by the Securities and Exchange Board of India (SEBI) (collectively referred as "Circulars") , Companies Act, 2013 and the Rules framed thereunder, as amended. In compliance with the above Circulars, electronic copies of the Notice of the AGM and Annual Report 2021-22 will be sent to all the shareholders whose e-mail addresses are registered with the Company/Depository Participant(s). Shareholders holding shares in dematerialized mode and whose e-mail addresses and mobile numbers are not registered or updated, are requested to register/update their e-mail addresses and mobile numbers with their relevant depositories through their depository participants. Shareholders holding shares in physical mode are requested to convert their shares in demat mode and furnish their e-mail addresses and mobile numbers with the Company at investors@anupamrasayan.com and its Registrar and Share Transfer Agent, KFin Technologies Limited at einward.ris@kfintech.com.

Shareholders will have an opportunity to cast their vote through remote e-voting system or during the AGM on the businesses set forth in the Notice of the AGM through an electronic voting system. The manner of voting for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their e-mail addresses will be provided in the Notice of the AGM. The manner in which the shareholders can give their mandate for receiving the dividends directly in their bank accounts through Electronic Clearing Service (ECS) or any other means will be as provided in the Notice of the AGM. The notice of the Nineteenth (19") AGM and Annual Report 2021-22 will also be made available on the Company's website at www.anupamrasayan.com and the websites of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com.

Shareholders who have not registered/updated their e-mail address are requested to get the same registered as stated above as the Company will send the Notice of the Nineteenth (19th) AGM and Annual Report for the financial year 2021-22 by way of an e-mail only to those shareholders whose e-mail addresses are registered with the Company/Depository Participants in terms of the aforementioned Circulars. However, shareholders who wish to get the physical copy of the Annual Report may write to the Company at investors@anupamrasayan.com mentioning their DP ID and Client ID. Upon receiving request, the same will be dispatched to the shareholders at the address registered with their Depository Participants.

> For Anupam Rasayan India Limited Sd/-

Date: August 13, 2022 Suchi Agarwal Place: Surat, Gujarat Company Secretary and Compliance Officer

Adfactors 234



Place: Hoskote

Managing Director

Date: 13.08.2022

**GLITTEK GRANITES LIMITED** CIN No.: L14102KA1990PLC023497

Regd. Office: 42, KIADB Industrial Area, Hoskote - 562 114. Extract of the Unaudited Financial Results for the Quarter ended 30th June, 2022

			(/	Amount ₹	In Lakhs)
	Particulars	Quarter ended 30.06.2022 (Unaudited)	Quarter ended 31.03.2022 (Audited)	Quarter ended 30.06.2021 (Unaudited)	Year to date figures for the previous year ended 31.03.2022 (Audited)
	Total income from operations (net)	291.33	245.79	141.07	941.47
2,	Net Profit / (Loss) from ordinary activities after tax	3.70	-30.22	-107.92	-230.72
5.	Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	3.70	-30.22	-107.92	-230.72
1.	Equity Share Capital	+01-100/D30000		1,329.08	
ò.	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year) Earnings Per Share (before extraordinary items)	503000	0.00	0.00	0.00
	(of ₹ 5/- each)	100000	10000		0 0000
	Basic:	0.01	-0.12	-0.42	-0.89
	Diluted:	0.01	-0.12	-0.42	-0.89
	Earnings Per Share (after extraordinary items) (of ₹ 5/- each)				
	Basic:	0.01	-0.12	-0.42	-0.89
	Diluted:	0.01	-0.12	-0.42	-0.89

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange websites www.bseindia.com and the Company's website www.glittek.com By Order of the Board,

> For Glittek Granites Limited Ashoke Agarwal Joint Managing Director

# INDIA GLYCOLS LIMITED

Regd Off:- A-1, Industrial Area, Bazpur Road, Kashipur - 244713, Distt. Udham Singh Nagar, Uttarakhand. Phone: +91 5947 269000/269500, Fax: +91 5947 275315/269535 E-mail: compliance.officer@indiaglycols.com; Website: www.indiaglycols.com CIN: L24111UR1983PLC009097

#### Notice of 38th Annual General Meeting, E-Voting Information and Book Closure

Notice is hereby given that the 38th Annual General Meeting ("AGM") of the Members of India Glycols Limited ("the Company") will be held on Wednesday, 7th September, 2022 at 11:00 A.M. through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") facility to transact the business as set out in the Notice convening the 38th AGM. The AGM will be held through VC/OAVM without the physical presence of the Members at a common venue in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ["SEBI Listing Regulations"] read with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 19/2021, 21/2021 and 02/2022 dated 8th April, 2020, 13th April, 2020, 5th May, 2020, 13th January, 2021, 8th December, 2021, 14th December, 2021 and 5th May, 2022, respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD1/ CIR/P/2020/79 dated 12th May, 2020 read with Circular Nos. SEBI/HO/CFD/CMD2/CIR/P/ 2021/11 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 15th January, 2021 and 13th May 2022, respectively, issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars"). The Deemed venue for AGM shall be the Registered office i.e. A-1. Industrial Area, Bazpur Road, Kashipur-244713, Distt. Udham Singh Nagar, Uttarakhand. In compliance with the MCA Circulars and SEBI Circulars, the Notice of the 38th AGM and Annual Report for the Financial Year 2021-22 which, inter-alia, comprises Audited financial statements (including the consolidated financial statements) of the Company for the financial year ended 31st March, 2022, Auditor's and Board's report thereon has been sent only by email to all those Members who have registered their email addresses with the Company or their respective Depository Participant ("DP") which was completed on Friday, 12th August, 2022. The Notice of the 38th AGM and Annual Report is also available on the Company's website www.indiaglycols.com, website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com and the website of Stock Exchanges, BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com. Members, who do not receive the Notice of 38th AGM and Annual Report, may download it from the Company's website or write to the Company Secretary at compliance.officer@indiaglycols.com. Notice is also hereby given pursuant to Section 91 of the Act read with applicable rules

thereunder and Regulation 42 of the SEBI Listing Regulations that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Thursday, the 1st September, 2022 to Wednesday, the 7th September, 2022 (both days inclusive) to determine the entitlement of the Members for the purpose of payment of dividend of ₹ 7.50/- per equity share (i.e. @ 75%) of face value of Rs. 10/- each for the financial year ended 31st March, 2022, as recommended by the Board of Directors at its meeting held on 26th May, 2022 for Financial Year 2021-22 and for the purpose of AGM. The dividend, if declared at the AGM, will be paid/dispatched within 30 days from the date of the AGM of the Company to all those (a) beneficial owner holding share in electronic form as per beneficial ownership data made available to the Company by the depositories as on Wednesday, the 31x August, 2022 (b) Members holding share in physical form, after giving effect to all the valid share transmission and transposition request lodged with the Company share transfer agent, MCS Share Transfer Agent Limited ("RTA") on or before Wednesday, the 31st August, 2022.

Further, in pursuance to the Income Tax Act, 1961, as amended by the Finance Act, 2020, dividend paid or distributed by a Company on or after 1st April, 2020 shall be taxable in the hands of the Members, therefore, the Company is required to deduct tax at source at the time of making payment of dividend at the prescribed rates. For the prescribed rates for various categories, please refer to the Finance Act, 2020 and the amendments thereof as well as our detailed communication sent to the Members through e-mail which is available at https://www.indiaglycols.com/investors/shareholders-communication.htm.

Pursuant to MCA General Circular 20/2020 dated 5th May, 2020 Companies are directed to

credit the dividend of the Members directly to their bank accounts using Electronic Clearing Service. Accordingly, Members are requested to provide/update their bank details with the respective depository participant for the shares held in dematerialized form and with the RTA in prescribed forms in respect of shares held in physical form. In the event the Company is unable to pay the dividend to any Member by electronic mode, due to nonregistration of the electronic bank mandate, the Company shall dispatch the dividend Further, pursuant to the provisions of Section 108 of the Act and applicable rules thereunder

and Regulation 44 of the SEBI Listing Regulations, the Company is providing to its Members the facility of remote e-voting before the AGM and e-voting during the AGM in respect of businesses to be transacted at the AGM and for this purpose, the Company has appointed NSDL for facilitating voting through electronic means. The AGM notice inter-alia, mentions the process and manner of remote e-voting and e-voting during AGM and instruction for participating in the AGM along with the instructions with regard to login credential for members holding shares in physical form or in demat forms who have not registered their e-mail addresses either with the Company/DP. The voting rights by remote e-voting/e-voting of the members shall be in proportion to their shares in the paid-up equity share capital of the Company as on cut-off date i.e. Wednesday 31st August, 2022.

All the members are informed that (a) the business as set out in the notice of 38th AGM may

be transacted through voting by electronic means; (b) the remote e-voting shall commence on Saturday, the 3rd September, 2022 at 9:00 A.M.; (c) the remote e-voting shall end on Tuesday, the 6th September, 2022 at 5:00 P.M.; (d) the cut-off date for reckoning the rights of Members for remote e-voting/ e-voting is Wednesday, the 31st August, 2022; (e) the remote e-voting shall not be allowed after 5:00 P.M. on Tuesday, the 6th September, 2022; (f) E-voting shall also be made available during the 38th AGM; (g) the members who have cast their vote on resolution(s) by remote e-voting prior to the AGM will also be eligible to participate at the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again during the 38th AGM; (h) person whose name is recorded in the register of Members/Beneficial Owners maintained by the depositories as on cut-off date i.e. Wednesday, 31" August, 2022 shall only be entitled to avail the facility of remote e-voting and e-voting at the AGM; (i) Persons who have acquired shares and become members of the Company after the notice has been sent electronically and holding shares as on the cut-off date i.e. Wednesday, the 31st August, 2022 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or admin@mcsregistrars.com; and (j) in case of queries, Members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members at the 'downloads' section of www.evoting.nsdl.com or contact Ms. Soni Singh, Assistant Manager, NSDL Trade World, 'A' wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai- 400013, at evoting@nsdl.co.in, Toll Free No. 1800 1020 990 and 1800 22 44 30 who will also address the grievances connected with the electronic voting. Members may also e-mail to the Company Secretary at compliance.officer@indiaglycols.com or send a letter at the Head office at Plot No. 2-B, Sector 126, Noida- 201304, Uttar Pradesh. Members whose e-mail addresses are not registered with the Company/Depository

Participant, may get the same registered by following below instruction, in order to obtain Annual Report for the Financial Year 2021-22:

Physical Holding Members holding shares in physical mode are requested to register/ update their email addresses by writing to MCS Share Transfer Agent Limited ("the RTA") at F-65, 1st Floor, Okhla Industrial Area, Phase-I, New Delhi- 110020 or email at admin@mcsregistrars.com along with the copy of the signed request letter mentioning the name, folio number and address of the Member, self-attested copy of the PAN card, self-attested copy of Aadhar and copy of share

certificate (front & back). Demat Holding Members holding shares in dematerialized mode are requested to register/update their email addresses by following the process mentioned above under- Physical Holding and send 16 digit DPID & Client ID in place of Folio No. along with scanned copy of self-attested Client Master copy or consolidated Demat Account

SEBI vide its circular No SEBI/HO/MIRSD/MIRSD RTAMB/P/CIR/2021/655 dated 3rd November, 2021 has mandated registration of PAN, KYC details including e-mail addresses and Nomination, by holders of physical securities. Members holding shares in physical form are requested to submit their PAN, KYC details including e-mail addresses and Nomination details by sending the prescribed forms to RTA at F-65, 18 Floor, Okhla Industrial Area, Phase I, New Delhi - 110020 or email at admin@mcsregistrars.com. The Company has also sent individual letters to all the Members holding shares of the Company in physical form in this regard. The letters and requisite forms are available on the Company's website (www.indiaglycols.com) under investor relations section. Members holding shares in electronic form are requested to verify and update their KYC details including e-mail addresses/ Bank mandate(s) or details of nomination to their respective Depository Participants.

The Company has appointed Shri Ashish Saxena (C.P. No.7096) of Ashish Saxena & Co. Company Secretaries, Ghaziabad as the scrutinizer to scrutinize the voting and remote e-voting process in fair and transparent manner. For India Glycols Limited

Ankur Jain

Place : Noida, U.P. Dated: 13th August, 2022 Company Secretary

financialexp.epar.in



# 



અાગાદીના અમૃત મહોત્સવ નિર્મિતે ગજેરા વિદ્યાભવન ઉત્રાણના વિદ્યાર્થીઓએ વિવિદ્ય સ્લોગનો સાથે પન્નાલાલ પટેલ પ્રા. શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું

કીવે ઉશનસ શાળા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

#### કાપડિયા હેલ્થ કલબ ખાતે કમિશનર અજયસિંહ તોમરના હસ્તે ધ્વજ વંદન કરાશે

મુખ્યક્ર પ્રતિનિધિ, સુરત, તા. ૧૩ કલળ, ન્યુ ભટાર રોડ ખાતે કરાવશે. ભારતને આઝાદી ૧૪મી અનેક સંસ્થાઓના સભ્યો તથા ઓગસ્ટની મધરાત પછીની પહેલી શહેરના નાગરિકો તેમાં જોડાઈને મિનિટે એટલે કે પથી ઓગસ્ટની પહેલી મિનિટ ૧૨:૦૧કલાકે મળી અવસરને આનંદ્રથી માણાર્ય, તો એ વહલા ભાગ : ૧૮૩૧ કરા મળા અવસરન આગદયા નહારા, તા અ તો એ સમય સાચવીને સુરતના શુભ અવસરે સર્વ નાગદિકોને મોટી પોલીસ કમિશનર અજયસિંહ તોમર સખ્યામાં ઇપસ્થિત રહેવા આગ્રહભરી વિધિપૂર્વક ધ્વજવંદન, કાપડિયા હેલ્થ વિનેતી કરાઈ છે.

#### ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા પક્ષના કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાશે

ધબકાર પ્રતિનિધિ સુરત, તા. ૧૩ રોજ સવારે ૧૧.૦૦ કલાકે પશનું ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા કાર્યાલય, વસંત ટોકીઝ પાસે, સ્ટેશન સર્વસમાવેસી, ધર્મીનરપેશ અને રોડ ખાતે પજુલંદન માટેનો કાર્યક્રમ સમાજવાદી ભારતના મૂલ્યો પ્રતે પોજાશે જેમાં ઇમ્પ્રેશત રહેવા શહેર કટિશદ્ધતા કેળવી તેને આગળ લઇ - જિલ્લા મંત્રી સુગીત પાઠકજી દ્વારા

#### સંઘર્ષના<u>ં સા</u>થી યુવા ટીમ દ્વારા પોલીસ્ જવાનોનાં પરિવારને આર્થિક સહાય અપાશે

૮ઃ૩૦ કલાકે સરદાર સ્મૃતિ ભવન સામાજીક આગેવાનો અને પોલીસ ખાતે આ કાર્યક્રમ યોજવામાં અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

**ધબકાર પ્રતિનિધિ, સુરત, તા. ૧**૩ આવશે. સ્વતંત્રાતા દિનની સંઘર્ષનાં સાથી યુવા ટીમ દ્વારા પૂર્વસંધ્યાએ યોજાનાર આ કોરોના દરમિયાન ચાલુ કરજે તથા કાર્યક્રમમાં શહિદો, વિરતા અને આકસ્મિક રીતે અવસાન પામેલા શૂરવીરતાની વાતો લોક સાહિત્યકાર સુરત શહેરનાં ૨૭ પોલીસ જવાનોનાં દ્વારા સંગીતમય શૈલીમાં પરિવારોને સન્માનિત કરી પ્રત્યેક શોર્યગાનના માધ્યમથી પીરસવામાં પરિવારને ૧-૧ લાખરૂપિયાની રાશિ આવશે. આ કાર્યક્રમમાં સુરત રવારા ૧૧ લાગ ફાવવામાં સાથે આવતા. આ કાવકાવા સુરા પૈશ કરાશે. શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાના તા. ૧૪ ઓગસ્ટની રાત્રો પ્રતિનિધિઓ, વિશીષ્ઠ વ્યક્તિઓ,

#### રવીન્દ્ર પારેખને 'પંકજ કાપડિયા પ્રેરણાસ્ત્રોત એવોર્ડ-૨૦૨૨' એનાયત કરાયો



ધબકાર પ્રતિનિધિ,

પટકથા લેખક પ્રકાશ કાપડિયા તરફથી **સુરત, તા. ૧૩** ૨૦૨૨નો 'પંકજ કાપડિયા શોર્ટ ફ્રિલ્મ મંત્રા પરિવાર પ્રેરણાસ્ત્રોત એવોર્ડ' ૭મી ઓગસ્ટને તરફથી ૧૧માં આંતરરાષ્ટ્રીય શોર્ટ રોજ યોજાયેલા સમારંભમાં એનાયત કિલ્મ ઉત્સવમાં જુદ્રી જુદ્રી કેટેગરીમાં થયો હતો. આ સમારંભમાં પંકજ સાહિત્યકાર તરીકે રવીન્દ્ર પારેખનું કાપડિયા પૂોતે પગ્ન એવોર્ડ આ અર્પગ્ન હેન્દી ફિલ્મ જગતના સંવાદ અને કરવા ઉપસ્થિત રહ્યા હતા



સિંગણપોર તરણકુંડ ખાતે તરવૈયાઓએ આઝાદીન મહોત્સની ઉજવણી કરી તિરંગાને સલામી આપી હતી

#### બીએસએફ દ્વારા ડો. વિનેશ શાહ તથા ડો. મેઘા ગૌરાંગ પટેલનું સન્માન કરાયું



સુરત, તા. ૧૩ આઝાદીના અમૃત મહોત્સવ તર્ગત સીમા સુરક્ષા બળ (બીએસએફ) ડ ક્વાર્ટર, ગુજરાત રાજ્ય દ્વારા પીક્ષી તબીબો ડો. વિનેશ શાહ તથા ડો. ગૌરાંગ પટેલનું સન્માન કરાયું હતું. પીક્ષી સંસ્થા મૃતદેહને એમ્બાલ્મિંગ

યાતા સસ્યા નૃતાદહા અન્યાહિય દારા તેના મૂળભૂત સ્વરૂપમાં સાચવવા દંપરાંત તેને તેના વતન સુધી હોંચાડવાની કામગીરી સાથે સંકળાયેલ પીક્ષી સંસ્થાના તબીબો દ્વારા ૭૫

લી. ગાંગણી ભાવનાબેન ગોરધનભા**ઇ** 



### પી. પી. સવાણી ગ્રુપ દ્વારા શહીદોના સમ્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

૭૫ વર્ષ આઝાટી ના પૂર્ણ થતા દેશનો આઝાટી સ્કૂલના મેત્રી હર્ષદભાઇ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા, માટે બલીદાન આપનાર વીરોની સ્મરણાંજલી રૂપે તેમજ ચેરમેન વલ્લભભાઇ સવાણી અને મહેશભાઇ આજરોજપી, પી. સવાણી ગ્રુપદ્વારા શહીદોના સમ્માનમાં સવાલીએ વચ્યુંલ હાજર રહીને પ્રસ્થાન કરાવ્યું હતું. ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી યાત્રામાં પી.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ, ઇ. એમ. ચેરીટેબલ ટ્રસ્ટ, પી. પી. સવાણી યુનીવર્સીટી, રેડીયન્ટ ઇગ્લીશ એકેડમી, પી. ત્યાં કુ હાયસાડા, રાજ્ય છે વ્યાસ પાંડિયા, યા. પી. સવાલી હોસ્પિટલ સ્ટાફ સામેલ હતા, શાળાની ૩૦-સ્કૂલ બસ, ૪- ફોરવ્હીલ, ૧૦- બાઇક જેવા વાહનોમાં ૯૦૦-વિદ્યાર્થીઓ, સ્કૂલ આચાર્યા, શિક્ષકો, શાળા પરિવાર સ્ટાક યાત્રામાં જોડાયા હતા. આ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરવા માટે ધારાસભ્ય

વી. ડી. ઝાલાવાડિયા, માજી ધારાસભ્ય પ્રફુલભાઇ પાનસેરિયા, માજી દિરેક્ટર સાથક સુગર મહેશાળાં સવાલી ચૈતન્ય વિદ્યા સંકુલના એકેડિમેક ડાયરેક્ટર કેસાઈ, અગ્રલી ભિલ્દર નરેશભાઇ ઉભરીયા, ચેરમેન વરાછા બેન્ક ભવાનભાઇ નવાપરા, અગ્રલી ભિલ્દર –વલ્લભભાઇ ચોથાણી, સંચાલક પી. પી. સવાલી જયંતીભાઇ ત્રાડા, આદર્શ ગામના પ્રક્રોતા સવજીભાઇ વેકરીયા, સમાજ અગ્રણી બીપીનભાઇ વિરાણી, પી. પી.

**ધબકાર પ્રતિનિધિ, સુરત, તા. ૧૩** સવાણી સ્કૂલના દ્રસ્ટી હિમતભાઇ સવાણી, પી. પી. સવાણી

આ યાત્રાનો પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકલ અબ્રામા ખાતેથી પ્રારંભ થયો હતો, જે લજામગ્રી ચોક મોટા વરાછા, સવજી કોરાટ બ્રિજ, સીમાડા નાકા, નાના વરાછા, કાપોદ્રા ચોકડી, હીરાબાગ સર્કલ, કાપોદ્રા-ઉત્રાણ વસાગા, કાપાદા ચાકડા, હારાભાગ સકલ, કાપાદા-ઉત્રાહ બ્રિજ, વીઆઇપી સર્કલ ઉત્રાણ, સુદામા ચોક, રામ ચોક જૂની ચેકપોસ્ટ અમરોલી, સવાણી ફાર્મ, અબ્રામા થઇ પી. પી. સવાલી સ્કૂલ, અબ્રામા ખાતે સમાપન કરવામાં

આવ્યું હતું. આ તિરંગાયાત્રાને સફળ બનાવવા માટે પી. પી. આ તિરંગાયાત્રાને સફળ બનાવવા માટે પી. પી. હોસ્પિટલ વિપુલભાઇ તળાવીયા તેમજ સુરત પોલીસના સાથ–સહકાર દ્વારા સફળતા અપાવી હતી.

પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ, ઇ. એમ. ચેરીટેબલ ટ્રસ્ટ, પી. પી. સવાણી યુનિવર્સિટી, રેડીયન્ટ ઈંગ્લીશ એકેડમી, પી. પી. સવાણી હોસ્પિટલનો સ્ટાફ યાત્રામાં જોડાયા

#### સચિનની શિવ શક્તિ રો હાઉસ સોસાયટી તિરંગાના રંગોથી શણગારાઇ : રહીશોએ 'જયહિંદ'ના નારા લગાવ્યાં

તિરંગા રંગની લાઇટિંગથી સોસાયટીના મુખ્ય દ્વારને પણ શણગારાયો, હાથમાં તિરંગો લઇ લોકોએ દેશભક્તિ દેખાડી

ધબકાર પ્રતિનિધિ.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઘર-ઘર તિરંગાને પહોંચાડવાની મુહિમ ચાલી રહી છે ત્યારે ચોર્યાસી તાલકા પંચાયતના પૂર્વ શાસકપક્ષના નેતા એવાં સોસાયટીના પ્રમુખ જગદીશભાઇ ભડીયાદરા, પૂર્વ તલાટી વસંતભાઇ પટેલ, સ્થાનિક અગ્રણી સંજયભાઇ કદમ, ઉદ્યોગકાર ગીરીશ ગોધાણી, બગવાનભાઇ રાજપૂરોહિત સહિતના આગેવાનોએ સોસાયટીને શશૂગારવામાં કોઇ કચાસ રાખી ન હતી. ૧૩મીના રોજ રાત્રે ૧૦ કલાકે સોસાયટીમાં રહેતાં મહત્તમ રહીશો પૈકી મહિલાઓ, બાળકો અને સોસાયટીના અગ્રણીઓ સોસાયટીના મુખ્ય દ્વાર ઉપર એકઠાં થયાં હતાં. દેશભક્તિનો એક સુંદર અને તિરંગા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરવા માટે 'જયહિંદ','જય જવાન' સહિતના નારા લગાવી તિરંગાનું સન્માન વધાર્યું હતું. બીજી તરફ અનેક નાના બાળકોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપ્યો હતો. આ પ્રસંગે સોસાયટીના અગ્રણી

પશ્ચિમ રેલવે એન્જિનિયરિંગ કામ દી ચીફ ઇલેક્ટ્રિકલ એ Lપશ્ચિમ રેલ્લે પ્રથમ મ 

સંજયભાઇ કદમે જાહેરાત કરી હતી કે ૧૫મી ઓગષ્ટે સવારે ૭.૩૦ વાગ્યે સોસાયટી સ્થિત નારેશ્વર મહાદેવ મંદિરથી રહીશો તિરંગા રેલી કાઢશે જે સોસાયટીના મુખ્યગેટ



ઉપર પહોંચી વિસર્જીત થશે. આ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. આ રેલીમાં જોડાઇને દેશભક્તિની યોજાયેલાં ૧૦મીનીટના કાર્યક્રમનું દર્શાવવા માટે તેમજ તિરંગાનું માન અમુક લોકોએ યાદગીરી રૂપે વધારવા માટે સૌએ હાજર રહેવાનું મોબાઇલ પણ શૂટીંગ કરી લીધું હતું.

#### 000 અનુપમ રસાચણ ઈન્ડીયા લીમીટેડ

સીઆઇએન — 124231GJ2003PL0042988 ૨જી. ઓઢીસ: અલુપમ રસાયણા ઇન્ડીયા લિ. ૮૧૧૦, સચિન જી.આઇ.ડી.સી. ઇન્ડ્ર્ટ્ટીઅલ ઇસ્ટેસ, સચિન, સુરત-૩૯૪૨૩૦, ગુજરાત, ઇન્ડીયા. ફોન નં.: +9 261 338991-95, બેનસાઈટ: www.anupamrasayan.com, ઈ મેઇલ: investors@anupamrasayan.com

#### વિડીચો કોન્ફરન્સ તેમજ અન્ય ઓડીચો વિઝયુઅલ માધ્યમે થનાર ૧૯ મી વાર્ષિક સામાન્ય સભા અંગેની માહિતી

હ્યા કર કો લો લોકિક સામાન્ય સભા એકોની માહિતી. પ્રદેશ ક્યાન આપવામાં આવે છે કે અનુમાન સ્થાના હોસ્સિંગ હોમીટેડ (લે) લોકિ સામાન્ય રાખા સુરાસ લાધીમ ૧૧૫ મો સાન્ટેમના સ્વરુ (લે) લોકિ સામાન્ય રાખા સુરાસ લાધીમ ૧૧૫ મો સાન્ટેમના સ્વરુ (લે) તે હામ કોમીરેટ અરેક (MCA) ના સર્જુલ ન . (વ. ૧૦૦૧ મામણાન્યો ૧૦૧૧ કોમી લેવા સર્જુલ ન . (૧/ ૧૦૦૧ લાધીમ ૯ ૧૦૦, સર્જુલ ન . ૧૦/ ૧૦૦૦ લાધીમ ૧૩ એક્લિ ૧૦૦૦ ન તું ૧૦૦૦ લાધીમ ૧૫ મે ૧૦૦૦ લાધીમ ૧૫ મે ૧૦૦૧ લાધી ૧૯ ૧૦/ ૧૦૦૧ લાધીમ ૧૫ મે ૧૦૦૧ લાધીમ ૧૫ મે ૧૦૦૧ લાધ સર્કા સા્રેસ્ટ્રીસ એક્ડ એકલ્લેસ્ટ્રીય લેકી અંક લોક્સિંગ લાધી ૧૫ લાધોમ ૧૫ મા ૧૦૫ લાધો ૧૫ લાધોમ લાધોમાં ૧૫ લા

કેશવેલા પોલાના ઇંગ્લેલ. આપ્ટાડી, તેથા મોળાઇલ બેલેસની immississ@@immissiasyan.com વર્ષના તેલા વર્ષાંગ્રેટ અને એક કે નીલ ટેસ્કોલોજી (લોકીટ એ @immissias@difinition.com વાળા ઇં જાઇ કરવા સુવાલામાં આવે છે. કે આપ્યાં કરામાન્ય સંત્રાનાના આપ્યાં કર્યા કર્યા કર્યું કર્યા કરાય કર્યા કર્યા

કંપની સેક્રેટરી તથા કોમ્પ

## આઇસીએ દ્વારા બે દિવસીય નેશનલ કોન્કરન્સ ૨૦૨૨નો પ્રારંભ થયો

ભારતમાંથી ૧ હજારથી વધુ ચાર્ટર્ડ એકાઉટન્ટ ભાગ લઇ રહ્યા છે

ધબકાર પ્રતિનિધિ **સુરત.તા.૧૩** ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ

ધો ઇન્સ્ટટવૃટ આફ ચાટડ એકોલ્ટન્ટન્ટ સુરત બ્રાન્ચ દ્વારા તા. ૧૩ અને ૧૪ ઓગસ્ટનાં રોજ ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ ૨૦૨૨ યોજાઇ છે. જેમાં ભરૂચ, નવસારી અને વાપી બ્રાન્ચ પણ જોડાતાં ભારતભારમાંથી હજારથી. વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ કોન્કરન્સમાં માંગ લઇ રહ્યાં છે.

ધબકાર પ્રતિનિધિ, સુરત, તા. ૧૩ ૧૫ મી ઓગસ્ટની ઉજવણી પૂર્વે આજે કવિશ્રી ઉશનસ્ શાળા કમાંક

૩૧૮માં ૬૫૦ બાળકોને 'હર ઘર તિરંગા' અભિયાન અન્વયે દાતાઓ

દારા રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા

ક્ષાલ લડ્ડમ કરાવા કરાવા હતા. શાળાના મુખ્ય શિક્ષક વિજયભાઇ ઝાંઝારૂકીએ આ માટે દાતાઓ સમક્ષ

ઝંઝાર્ડીએ આ માટે દાતાઓ સમય ટેકલ નાખી હતી.
દાતા ધર્મજય પટેલે ૨૦૦ સફ્લાન પાત્રી શ્રાહ્મેએ ૧૦ ન્યુન્ડ સાથાના ૧૫ શ્રિશ્લોએ ૧૦ ન્યુન્ડ રાષ્ટ્રાલ્ય સાથાના ગરસેવા ઇન્ડે સ્થિતિ પાર્ટેલના પ્રયત્નાથી અંત્રેને અને પટેલના પ્રયત્નાથી અંત્રેને અંત્રેને અંત્રેને અંત્રેને સાથાના વર્ગ સાથાના પર સાથાના



ભાગ લઇ રહ્યાં છે. આ ટેક્સ ને સાથે અને છણાવટ આ એમને લાગ લેક્સનાર પૂર્વ કે ચર્ચા અને છણાવટ એકાઈન્ટ્ર હારા સકળ ઓહિસ સ્ટાક અને અતુલ ગુમાં ઉપરાંત સીએ ગુરાસાદ, કરશે. આ ઉપરાંત શોએ ગુરાસાદ, કરશે. આ પણ પિરાન શાર્ટી એકાઉન્ટ્ર સેનેજિય્દ સ્ટાન અને ડેટા વિસ્ત્રેપાલમાં કરિલ ગોંચત તથા આ ઇડીએઆઇ નાં મન્યા સંચાલિત સ્કૃતના વર્ષમાં પોરસામાં વ્યવસાધી કરતી છે. ગોંચત તથા આ ઇડીએઆઇ નાં મન્યા સંચાલિત સ્કૃતના વર્ષમાં પોરસામાં વ્યવસાધી કરતી છે. આ આ પણ કરતા વિશ્રાયીઓને એકાઉન્ટ સાથે સાથી દિશામાં એકાલ અને વૈલિક છે. પણ પણ બળુ અને આ આપાના નિયાય પર સીએ હતા ભાવવાની સેના સ્ત્રેસ સાથે ડિસામાં અને અને આ પણ નાં ભાવીરાય કાર્ય પણ ભાવવાની સંચાલ સર્વા સાથે હતા કરતી વિશ્રાયા સર્ચિય કાર્ય પારસામાં અને આપાના ભાવીરામાં સર્ચિય કાર્યો પારસામાં અનુભાવ સાથે આ આપાના ભાવીરામાં સર્ચિય કાર્યો પારસામાં અનુભાવ સાથે આ આપાના વર્ષો અને અને અને માર્ચિક કરતી સ્ટુઆત સાથે સન્માન પણ કરવામાં આવશે.

નામ બદલેલ છે

મારુ જૂનું નામ ગોરધનભાઈ અરજણભાઈ હતું જે બદલીને નવું નામ ગાંગાણી ગોરધનભાઈ અરજણભાઈ રાખેલ છે. જેની સર્વે નોંધ

മപ લી. ગાંગામી ગોરદાતભાદ અરજણભાઈ સરનામુંઃ ૩૦૬ સુરભી સોસાયટી, પાસોદરા પાટિયા, કામરેજ,સુરત.

સરનામુંઃ ૩૦૬ સુરભી સોસાયટી, પાસોદરા પાટિયા, કામરેજ,સુરત.